

#### August 14, 2024

To,
The Listing Department **BSE Limited**Phiroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai: 400 001

Ref: Script Code: 539384

Sub: Newspaper Publication: Notice of 30th Annual General Meeting, Remote E-

voting information and Book Closure etc.

Dear Sir / Madam,

Please find enclosed herewith copies of newspaper advertisements published in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) on **August 14, 2024**. Regarding E-Voting information for the 30<sup>th</sup> Annual General Meeting In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. Inter-alia, intimating that of 30<sup>th</sup> Annual General Meeting of the Company will be held on **Friday, September 06, 2024 at 4.00 P.M.** through VC/OAVM facility.

The same is also available on the website of the company www.kcsl.co.in.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully, For, **Krishna Capital & Securities Limited** 

Ashokkumar Agrawal (Managing Director) (DIN 00944735)

# "Hum Hamare Hak Mangate, Nahi Kisi Se Bhik Mangate"

Bharatiya Waghai Anganwadi **Employees** Mahasangh on Monday in Navsari District Collector's Office Resident Additional Collector Ketan Joshi gave a petition to Chief Minister Bhupendrabhai Patel and Minister for Women and Child Development Bhanuben Babaria regarding the outstanding issues of all Anganwadi sisters workers and helpers. Anganwadi workers and sisters of all talukas of the district reached the Navsari Collector office to Development Bhanuben

**Particulars** 

Total income from operations

Total Comprehensive Income

Paid-up Equity Share Capital

exceptional items

Earning Per Share

Place: Ahmedabad

Date: 12.08.2024

Basic

Diluted

Net Profit/Loss for the Period Before tax and

Net Profit/ (Loss) before tax after exceptional items

**Particulars** 

4 Net Profit/ (Loss) after Tax and Exceptional Items



Resident Additional Collector Ketan Joshi to Chief Minister Bhupendrabhai Patel and Minister for Women and Child deliver the application letter to Babaria with a presentation

Vasudhagama Enterprises Limited

L65910GJ1989PLC012835

Address: G-04, Newyork Corner Building Behind Kiran Motors, G Highway Bodakdev Ahmedabad GJ 380054

Email id: vasudhagamaenterprises@gmail.com, website:www.vasudhagama.com

(EXTRACT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER / YEAR ENDED

ON 30TH JUNE, 2024)

550.79

57.83

43.38

43.38

0.26

Exchange website (www.bseindia.com) and on the Company 's website www.vasudhagama.com

Note: The above is an extract of the detailed format of Audited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchange under

Regulation 33 of the SEBI( Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full financial results are available on Stock

**RAJ RAYON INDUSTRIES LIMITED** 

Registered office: Survey No. 177/1/3, Village - Surangi, Dist - Silvassa, Dadra & Nagar Haveli (UT) - 396 230.

Tel: 91-22-40343434, Fax: 91-22-40343400, email: investors@rajrayon.com,

Website: www.rajrayon.com CIN No. L17120DN1993PLC000368

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

1696.45

Quarter

449.72

41.34

30.31

30.3

1696.45

0.18

Standalone

30th June.

150.29

10.87

10.87

7.06

7.06

0.19

Quarter Ended

(Audited)

1696.45

31st

March.

Audited

124.81

124.81

92.80

92.80

1696.45

0.11

0.11

ended

Un audited

117.89

117.89

88.43

88.43

1696.45

0.52

For Vasudhagama Enterprises Limited

1288.22 1.006.92

30th June

regarding the outstanding issues of the workers and helpers of all Anganwadi sisters. Where he presented outstanding questions. In which, according to the

Amount in Lakhs

2024 31-03-24 Audited Audited

Year

2112.97

216.28

216.28

161.40

161.40

0.19

0.19

1696.45

Consolidated

31st Marc

828.39

80.92

80.92

59.99

59.99

1696.45

0.35

Sejal Sanjiv Shah

DIN: 09591841

Year Ended

(Audited)

supervisor without age limit and in those districts where recruitment has stopped due to stay, taking a policy decision to give immediate promotion without age limit, immediate payment of mobile money and increase in cost of blouse sewing, hot snacks and spices. Pay attention to increase and timely payment of graduation fees and M.M.Y. Paying the rent

seniority of the municipality of stock, making the and all the districts, immediate anganwadi time 10.30 to 3 pm promotion of the worker to and giving supplementary nutrition to the beneficiary's house during the vacation and giving the worker-helper a vacation together, paying the money of the anganwadi charge and giving incentives and hiring tourist workerhelper if there are long vacations, workers outside the time of anganwadi Along with various demands including not to bother for information.

## PARKER AGROCHEM EXPORTS LIMITED

(CIN: L24110GJ1993PLC020102) Registered Office: Block H, Plot 3 & 4, New Kandla - 370 210 (Kutch)E mail: parkeragro\_abd@yahoo.in website:www.parkeragrochem.com

#### NOTICE FOR UPDATING EMAIL ADDRESSES, MOBILE NUMBER OF SHAREHOLDERS

Parker Agro-chem Exports Limited requests all its shareholders to register their E-mail addresses and Mobile Number as per the procedure laid down. This will facilitate the Company for sending Annual Report, Notice of General Meeting and any other important communications electronically in compliance with Circular No. 14/2020 dated 8th April, 2020, Circular No. 17/2020 dated 13th April, 2020, Circular No. 20/ 2020 dated 5th May, 2020, Circular No. 02/2021-22 dated 13th January, 2021 Circular No. 02/2022 dated 5th May, 2022, Circular No. 10/2022 dated 28th December 2022 and Circular No. 09/2023 dated 25th September, 2023 issued by the Ministry f Corporate Affairs and SEBI Circular dated 12th May, 2020, SEBI Circular dated 15th January, 2021, SEBI Circular dated 13th May, 2022, SEBI Circular dated 5th January, 2023 and SEBI Circular dated 7th October, 2023. Registration Procedure:

Shareholders holding shares in physical form are requested to send following details to the Company's Registrar and Share Transfer Agent [M/s. Link Intime (India) Private Limited] at their address or on their E-mail Id: rnt.helpdesk@linkintime.co.in or at the Registered Office of the Company or at its E-mail Id: parkeragro\_abd@vahoo.in:

i. Full N	ame	vi.	No. of Shares held				
ii. Addre	SS	vii.	Folio No				
iii. Email	Address	viii.	Certificate No.				
iv. Mobile	. No	ix.	Distinctive No.				
v. Original scan Copy of Pan and Aadhar Card							

b) Shareholders holding shares of the Company in dematerialized form but who have not registered their email address and/or mobile number are requested to approach their respective Depository through Depository Participant.

In view of aforesaid MCA & SEBI circulars, the Company is in the process o convening 31st Annual General Meeting through Video Conferencing and Other Audio Visual Means (VC & OAVM) without any physical presence of its members. The Annual Report including Notice of 31st AGM will be dispatched in due course to the members on their registered E-mail Id. Hence, it is highly recommended and Members are earnestly requested to get their E-mail I registered with the Company. The Notice of 31st AGM will contain detailed instructions for attending and participation in 31st AGM as well as for casting o vote through Remote E-Voting process or through E-voting during 31st AGM For any clarification, please Contact Company's Registrar and Transfer Agent M/s. Link Intime (India) Private Limited 5th Floor, 506 to 508, Amarnath Busines: Centre - 1 (ABC-1), Beside Gala Business Centre, Nr. St. Xavier's College Corner Off C. G. Road, Ellisbridge, Ahmedabad - 380006 at their Phone: 079-26465179 E-mail id rnt.helpdesk@linkintime.co.in. or at the Registered office of the Company at Block H, Plot 3 & 4, New Kandla- 370 210 (Kutch)

By Order of the Board, For PARKER AGROCHEM EXPORTS LIMITED

JAGDISH R. ACHARYA Date: 13-08-2024 (DIN NO. 01251240) CHAIRPERSON 8 MANAGING DIRECTOR

(₹ in Lakhs, unless otherwise stated) (except per equity share data

(Unaudited)

30th June, 2023 31th March, 2024 30th June, 2023 31st March, 2024

Not	001				
	Diluted (in Rs.)	(0.04)	(0.03)	0.00	0.05
	Basic (in Rs.)	(0.06)	(0.04)	0.01	0.07
8	Earning Per Share (Face Value of Re. 1/- each)	(not annualised)	(annualised)	(not annualised)	(annualised)
7	Other Equity				2,759.26
6	Equity Share Capital	5,560.82	5,560.82	5,560.82	5,560.82
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	(347.48)	(212.44)	29.18	405.59
4	Net profit / (loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(347.80)	(214.03)	29.28	404.30
3	Net profit / (loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(250.62)	42.64	25.29	992.98
2	Net profit / (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(250.62)	42.64	25.29	992.98
1	Total Income from Operations (Net)	20,316.18	21,802.05	15,589.33	75,029.64

- a. The above audited results have been reviewed and recommended by the Audit Committee and approved by board of directors in their meetings held on August 13, 2024.
- These results have been prepared in accordance with Indian Accounting Standards as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016 c. The audit as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by
- the auditors of the Company and they have expressed a modified conclusion. The full format of the year ended Financial Results is available on the websites of the stock exchanges i.e. www.bseindia.com and www.nseindia.com

For and on behalf of Board of Directors Raj Rayon Industries Limited

Place: Mumbai Date: August 13, 2024

annualised)

arnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each)

iluted:

Mr. Rajkumar Satyanarayan Agarwal **Managing Directo** 

0.032

0.032

0.032

Place : Ahmedabad

Date: 13.08.2024

# **ASHNISHA INDUSTRIES LIMITED**

Registered Office. 7th Floor, Ashoka Chambers, Opp. HCG Hospital, Mithakhali Six Roads, Ahmedabad 380 006. CIN:L74110GJ2009PLC057629

STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR

THE QUARTER ENDED JUNE	30, 2024		( Rs. In Lakhs)
Particulars	Quarter ending	Previous Year ended	Corresponding 3 months ended in the previous year
	pre Tax, Exceptional and/or Extraordinary		30-06-2023
	Unaudited	Audited	Unaudited
Total income from operations	150.01	1487.33	266.99
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary			
items)	5.08	143.36	31.38
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or			
Extraordinary items)	5.08	143.36	31.38
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or			
Extraordinary items)	5.08	95.57	31.38
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the			
period (after tax) and other comprehensive income (after tax)]	5.08	95.57	31.38
Equity Share Capital	1010.00	1010.00	990.00
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)			

0.005 0.095 EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

		( RS. In Lakns)	
Quarter ending		Corresponding 3 months ended in the previous year	
30-06-2024	31-03-2024	30-06-2023	
Unaudited	Audited	Unaudited	
48.56	535.40	217.63	
3.89	84.46	30.24	
3.89	65.12	30.24	
	30-06-2024 Unaudited 48.56	ending ended  30-06-2024 31-03-2024  Unaudited Audited  48.56 535.40  3.89 84.46	

Date: 13-08-2024

Place: Ahmedabad

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www. bseindia.com) and the company's website (www.ashnisha.in)

For, ASHNISHA INDUSTRIES LIMITED ASHOK C. SHAH MANAGING DIRECTOR

DIN: 02467830

0.09

0.00

#### **KRISHNA CAPITAL & SECURITIES LIMITED** (CIN: L67120GJ1994PLC023803)

Registered Office: 403, Mauryansh Elanza, B/h. Parekh Hospital, Shyamal Cross Road, Satellite, Ahmedabad - 380015. Phone: 079-26768572, 26768573,

F-Mail: kshsnl@vahoo in Wehsite: www.kcsl.co

### NOTICE OF THE 30th ANNUAL GENERAL MEETING. **BOOK CLOSURE & E-VOTING INFORMATION**

NOTICE is hereby given that the 30th Annual General Meeting (AGM) of the Members of the Krishna Canital & Securities Limited will be held on Friday September 06, 2024 at 4.00 P.M through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact business as set out in the notice of AGM which is being circulated for convening the AGM

The Company has sent Annual Report for the financial year 2023-2024 along with the Notice convening AGM. through electronic mode to the Members whose email addresses are registered with the Company and / or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. Annual Report for the financial year 2023-2024 along with the Notice convening the AGM is also available on the website of the Company at http://kcsl.co.in/Noticeweb.aspx and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 ("Act") and the applicable rules framed thereunder that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, August 30, 2024to Friday, September 06, 2024 (both days inclusive) for the purpose of 30th Annual General Meeting of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules. 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations. 2015, the Members are provided with the facility to cast their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Friday, August 30, 2024 ('cut-off date').

The remote e-voting period commences on Tuesday, September 03, 2024 at 9.00 a.m. IST and will end on Thursday, September 05, 2024 at 5.00 p.m. IST. During this period, the Members may cast their vote electronically. The remote evoting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com under help section or contact at 022-23058542/43. In case of any grievances relating to e-voting, please contact Mr. Rakesh Dalvi, Manager. at 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbai: 400013; Email : helpdesk.evoting@cdslindia.com or aforesaid number.

The details of the AGM are available on the website of the Company at www.kcsl.co.in.CDSL at www.evotingindia.com. BSE Limited at www.bseindia.com.

BY ORDER BY THE BOARD. For, Krishna Capital & Securities Limited Ashokkumar Agrawal **Managing Director,** 

DIN 00944735

**YASH CHEMEX LIMITED** 

411, 4th Floor, Sigma Icon-1, Opp. Medilink Hospital, Satellite, Ahmedabad - 380015, Gujarat, India, Tele: 079-40028639/26730257/26730258, Email: yashchem@hotmail.com, Website: www.yashchemex.com, CIN: L74110GJ2006PLC048385

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2024.  (Rs. in Lakhs, except EPS)									
		Standalo	ne Un-Audit	ed Financial R	esults	Consoli	dated Un-Au	ıdited Financia	l Results
Sr. No.	PARTICULARS	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/06/2023	Quarter Ended 31/03/2024	Year Ended 31/03/2024	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/06/2023	Quarter Ended 31/03/2024	Year Ended 31/03/2024
1.	Total Income from Operations	793.22	1,250.34	1,962.54	6,214.74	1,369.28	2,554.33	3,257.93	9,652.58
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	75.87	(261.22)	37.45	(156.45)	207.99	(417.73)	162.10	(7.08)
3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	75.87	(261.22)	37.45	(156.45)	207.99	(417.73)	162.10	(7.08)
4.	Net Profit for the period after Tax (after Exceptional and / or Extra-ordinary items)	23.76	(183.32)	34.34	(91.24)	126.02	(306.25)	135.66	32.86
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(13.43)	(110.69)	(25.05)	(36.01)	88.83	234.84	76.27	86.87
6.	Equity Share Capital of Face Value Rs. 10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34
7.	Earnings Per Share(face value of Re.1/-each) (for continuing and discontinued operations)								
	A : Basic B : Diluted	0.23 0.23	(1.79) (1.79)	0.34 0.34	(0.89) (0.89)	0.93 0.93	(2.41) (2.41)	2.51 2.51	(0.27) (0.27)

The above is an Extract of the detailed format of Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30,2024 filed with the Stock Exchange unde Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30,2024 are available on the Stock Exchange website, i.e. www.bseindia.com and on the website of the Comapny i.e. www.yashchemex.com.

The above Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30,2024 have been reviewed by the Audit Committee & approved by the Board of Directors of the Company at their respective meetings held on August 13,2024.

By Order of Board of Directors For Yash Chemex Limited SD/-, Pritesh Y. Shah ging Director, DIN: 00239665

6.770.27

(Annualised)

2.89

2.89

6.485.27

**Annualised** 

0.48

ANJANI SYNTHETICS LIMITED

CIN:L11711G.I1984PLC007048

Registered Office: 221 (Maliya), New Cloth Market O/s Raipur Gate, Ahmedabad, Gujarat, India, 380002. Website: www.anianisynthetics.com, E-Mail: accounts@anianisynthetics.com

#### EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2024 (Rs. IN LAKHS Except EPS) Quarter Ended **Year Ended** 30.06.2023 31.03.2024 **PARTICULARS** 30.06.2024 31.03.2024 No. (Unaudited) (Audited) (Unaudited) (Audited) 1. Total Income from Operations 5883.93 25676.94 4407.45 6536.57 2. Net Profit / (Loss) for the period 140.43 96.86 473.77 70.87 (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax 473.77 (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax 425.68 53.03 169.42 71.41 (after Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) 53.03 246.05 71.41 502.31 and Other Comprehensive Income (after tax)] **Equity Share Capital** 1475.00 1475.00 1475.00 1475.00

**Basic** 

Diluted :

1. The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held on 13/08/2024. The statutory auditor of the Company have reviewed the said result.

6.823.30

0.36

6,770.27

1.15

(Not Annualised) (Not Annualised)

- 2. The financial results have been prepared in accordance with the companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) as amended prescribed under section 133 of the companies act, 2013 read with rules thereunder and in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and SEBI Circular dated July 5, 2016.
- 3. Operations of the Company falls under single reportable Segment i.e. 'TEXTILE'.

Reserves (excluding Revaluation Reserve) as shown

in the Audited Balance Sheet of the previous year

8. Earning per share (of Rs. 10/- each)

- 4. The financial results for quarter ended 30th June, 2024 have been subjected to Limited Review by the statutory auditors of the company. The Limited Review Report does not contain any qualifications.
- 5. The figures for corresponding previous periods have been regrouped/rearranged wherever necessary.
- 6. The Figures for the quarter ended 31st, March 2024, are the balancing figures between audited figures in respect of full

financial year and published unaudited year to date figures upto the third quarter of the financial year ending March 31, 2024.

For, Anjani Synthetics Limited, Place : Ahmedabad Vasudev S. Agarwal Date : 13 08 2024 (Managing Director) (DIN - 01491403)

## **AMARNATH SECURITIES LIMITED**

CIN No. L67120GJ1994PLC023254

Reg. office:- 1/104, Sarthak, Opp. C.T. Centre, B/H. Swastik Cross Road, C.G. Road, Ahmadabad - 380009. Corporate Office:- Office No. FC-20, 2nd Floor, Building Name Eternity Mall Road, LBS Marg, Near Teen Hath Naka. Thane West 400604.

STATEMENT OF LINAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2024

Sr.		G	uarter ende	d	Year ended	
No.	Particulars	30.06.2024	31.03.2024	30.06.2023	31.03.2024	
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	
1	Revenue from operations	9.710	9.671	10.188	40.874	
	Other income	-	0.009	-	0.059	
	Total revenue	9.710	9.680	10.188	40.933	
2	Expenses					
	Employee benefits expenses	0.900	0.700	1.050	3.400	
	Finance Cost	0.500	0.486	1.268	3.046	
	Depreciation and amortization expenses	-	-	-	-	
	Other expenses	1.546	0.798	5.179	8.292	
	Total expenses	2.947	1.984		14.737	
3	Profit/(Loss) before Exceptional Items and Tax (1-2)	6.763	7.696	2.691	26.195	
	Exceptional Items	-	-	-	-	
;	Profit/(Loss) Before Tax	6.763	7.696	2.691	26.195	
3	Tax expense:					
	(1) Current tax	1.836	2.059	0.717	7.485	
	(2) Deferred tax	-	-	-	-	
7	Profit/(Loss) from ordinary activities after tax	4.927	5.637	1.974	18.711	
3	Other Comprehensive Income (OCI)					
	Item that will be reclassified to profit or loss					
	Gain/(Loss) on recognised on fair valuation					
	of Financial Assets	-	-	-	-	
	Income tax relating to these items	-	-	-	-	
	Total Other Comprehensive Income (OCI)	-	-	-	-	
9	Profit (Loss) for the period	4.927	5.637	1.974	18.711	
	Paid up Equity Share Capital					
	(Face Value of Rs. 10 each)	300.020	300.020	300.020	300.020	
10	Earning Per Share (EPS) (Not annualised)					
	(1) Basic	0.16	0.19	0.07	0.62	
	(2) Diluted	0.16	0.19	0.07	0.62	

- The above Financial Results which are published in accordance with the regulation 33 of the Securities and Exchange Board Of India (Listing obligations & Disclosure Requirements) Regulations, 2015 have been reviewed and recommended by Audit Committee and has been approved by the Board of Directors at its Meeting held on Tuesday
- 2. The figures for the quarter ended 31 March 2024 are a balancing figure between the audited figures of the full financial year and the unaudited year to date figure upto the third guarter of the financial year ended 31 March, 2024.
- 3. The statutory auditors have carried out limited review of the standalone unaudited financial results for the quarter ended 30th June 2024 and have issued an unmodified review report.
- 4. The company has only one business segment.

For Amarnath Securities Limited Naresh Padhir Whole-Time Diretor

Place: Ahmedabad (DIN- 08379067) Dated: 13thAugust, 2024

લોક્મિત્ર, LOKMITRA

# હિંડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીના કોંગ્રેસનું ષડયંત્ર: રવિશંકર પ્રસાદ

નવીદિલ્હી, ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે, આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિંડનબર્ગને ગત જુલાઈમાં નોટિસ આપવામાં આવી હતી પરંત તેનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અને તેમની ટુલકીટ દેશને નફરત કરે છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ પણ સામેલ છે. હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર શેરબજાર સ્થિર છે. હિડનબર્ગ રાજકીય ગરમાવો વધી ગયો છે. હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે દેશ વિરુદ્ધ આર્થિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી પ્રચાર ચલાવે છે. શેરબજારને હચમચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ. આજે સોમવારે હિંડનબર્ગ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે ફરી શરૂ કરોપ કોંગ્રેસનું રાજકારણ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા દ્વકીટ અને ચિટ પર ચાલે છે. કહ્યું કે કોંગ્રેસ અને તેની ટુલકીટ દેશને નફરત કરે છે. ક્યારેક રાફેલનો પત્ર. ક્ચારેક હિંડનબર્ગનો અહેવાલપ આખરે કોંગ્રેસ શું ઈચ્છે છે ? દેશની પ્રગતિને રોકવાનું ષડયંત્ર છે. તેઓ આરોપ લગાવીને ભાગી જાય છે. હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ (હ્નર્ઢેં)ને આવત રોકવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા



મોદીના પીએમ બનવાથી કોંગ્રેસ ચિંતિત છે. કોંગ્રેસને પીએમ પ્રત્યે નફરત છે. ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. તેથી આજે પણ ભારતનું મારફતે કોંગ્રેસ, દેશનું શેરબજાર અને નાના રોકાણકારોને બરબાદ કરવા માંગે છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિંડનબર્ગમાં જયોર્જ સોરોસનું મુખ્ય રોકાશ છે, જેઓ ભારત વિરુદ્ધ સતત દષ્પ્રચાર ચલાવે છે. કોંગ્રેસ જણાવે કે તેઓ શું ઈચ્છે છે ? મોદીને નફરત કરતી વખતે કોંગ્રેસ દેશને નફરત કરવા લાગી છે. જો ભારતનં શેરબજાર બગડશે તો નાના રોકાણકારો પાયમાલ થશે. ટુલકીટ વાળા લોકોને ભારતના વિકાસની ચિંતા નથી. ક્યાંકથી ચિટ મેળવો અને ક્ચારેક રાફેલની ચિટ તો ક્ચારેક હિંડનબર્ગની ચિટ. કોંગ્રેસના જૂના નેતાઓ કેમ ચૂપ છે? હિંડનબર્ગને નોટિસ આપવામાં આવી છે. સેબીએ જુલાઈમાં હિંડનબર્ગને નોટિસ આપી હતી પરંતુ જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો હતો. સેબી એક્ટમાં સુનાવણી અને અપીલ બંનેની જોગવાઈ છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, તેમને આશા હતી કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને

વિમુખ રહ્યાં બાદ સંયમ અને શાંતિ જાળવી રાખશે, પરંતુ તેમને મોદી સામે નફરત છે અને મોદીને હટાવવાના પ્રયાસો કરી રહ્યા છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. દેશમાં આર્થિક અરાજકતા અને આર્થિક અસ્થિરતા સર્જવાના પ્રયાસો કોંગ્રેસ અને તેની ટુલકીટ દ્વારા થઈ રહ્યા છે. ગઈકાલ રવિવારે, લોકસભા વિપક્ષના નેતા રાહલ ગાંધીએ, હિંડનબર્ગના નવા રિપોર્ટ પર સેબી અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સેબી ચીફ વિરુદ્ધ રિપોર્ટમાં ખુબ જ ગંભીર આરોપો મકવામાં આવ્યા છે. આનાથી સેબીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. રાહુલ ગાંધીએ એવો પ્રશ્ન પણ કર્યો હતો કે, સેબીના વડાએ હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? રોકાણકારોનું નુકસાન કોણ ભરપાઈ કરશે?

**બાંગ્લાદેશ,** બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની ફરજ પડી હતી. શેખ હસીનાએ તેમના નાટકીય રાજીનામા પછી અને દેશ છોડીને ભારતમાં ભાગી ગયા પછી પ્રથમ વખત ખુલ્લેઆમ વાત કરી છે, તેમની અણધારી હકાલપટ્ટીમાં અમેરિકાની ભૂમિકા તરફ ઇશારો કર્યો છે.

મીડિયા અહેવાલ મુજબ, પૂર્વ પીએમ શેખ હસીનાએ કહ્યું છે કે, દેશમાં વધુ હિંસા ન થાય તે માટે મેં રાજીનામું આપ્યું. તેમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના મતદેહો પર રાજકારણ કરી સત્તા મેળવવાનો હતો, પરંતુ મેં રાજીનામું આપીને તેમને આમ કરતા અટકાવ્યા. બાંગ્લાદેશમાં હાલમાં ભારે રાજકીય ઉથલપાથલની સ્થિતિ છે, જો કે હવે વચગાળાની સરકાર પણ અસ્તિત્વમાં આવી છે. શેખ હસીનાએ



સેન્ટ માર્ટિન આઈલેન્ડની સર્વોપરિતા છોડી દીધી હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર નિયંત્રણ મેળવવાની મંજૂરી આપી હોત, તો હું હજુ પણ સત્તામાં હોત. વધુમાં તેમણે કહ્યું કે, હું મારા લોકોને વિનંતી કરું છું, કૂપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.

અગાઉ મે મહિનામાં શેખ એવો પણ દાવો કર્યો હતો કે, જો મેં હસીનાએ બાંગ્લાદેશ અને

મ્યાનમારના ભાગોને વિભાજિત કરીને પૂર્વ તિમોર જેવું ખ્રિસ્તી રાજ્ય બનાવવાનં ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો તેઓ કોઈ વિદેશી દેશને બાંગ્લાદેશમાં એરબેઝ સ્થાપવાની મંજૂરી આપે તો તેમને સરળતાથી ફરીથી ચૂંટણી જીતવાની તક આપવામાં આવી હોત, જો કે તેમણે તેમાં સામેલ દેશનું નામ લીધું ન હતું. હસીનાએ કહ્યું કે જો તે દેશમાં રહી હોત તો વધ હિંસા ફાટી નીકળી હોત. જેના પરિણામે મોટી સંખ્યામાં મૃત્યુ અને મોટા પ્રમાણમાં વિનાશ થયો હોત. તેમણે કહ્યું કે હું તમારી નેતા બની છું કારણ કે તમે મને પસંદ કરી છે. તમે લોકો મારી તાકાત હતા.

દેશભરમાં ફેલાયેલી હિંસામાં ૨૩૦થી વધુ લોકોના મોત થયા હતા. જયારે જલાઈના મધ્યમાં દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. હસીનાએ દેશમાં થઈ રહેલી વ્યાપક હિંસા, પાર્ટીના નેતાઓની હત્યા, કાર્યકર્તાઓની શબ્દનો ઉપયોગ ઘણીવાર એવા ઉત્પીડન અને તોડફોડ અંગે ઊંડું દુઃખ લોકોના વર્શન માટે થાય છે જેઓ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે ૧૯૭૧ના મુક્તિ યુદ્ધ દરમિયાન મને સમાચાર મળ્યા કે હિંસામાં ઘણા નેતાઓ માર્યા ગયા છે, કાર્યકરોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના ઘરોમાં ભારે તોડફોડ અને આગચંપી કરવામાં આવી રહી છે. ત્યારે મારું દિલ રડી રહ્યું છે.

બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરીશ, મારા પિતાએ આ દેશ માટે વિદ્યાર્થીઓને સંબોધતા શેખ હસીનાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ક્ચારેય 'રઝાકર' કહ્યા નથી. અવામી સંભાળ્યો હતો.

હસીનાના રાજીનામા બાદ લીગના નેતા શેખ હસીનાએ કહ્યું કે, તમને ઉશ્કેરવા માટે મારા શબ્દો સાથે છેડછાડ કરવામાં આવી હતી. તમે લોકો તે દિવસનો મારો આખો વીડિયો જુઓ અને સમજો કે કેવી રીતે કાવતરાખોરોએ દેશને અસ્થિર કરવા માટે તમારી નિર્દોષતાનો ફાયદો ઉઠાવ્યો છે. દેશમાં "રઝાકાર" પાકિસ્તાન આર્મી સાથે સહયોગી હોવાનું માનવામાં આવે છે.

સરકારી નોકરીઓ માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને તેઓ તેને નાબૂદ કરવા માટે ભગવાનની કૃપાથી હું જલ્દી દેશભરમાં વિરોધ કરી રહ્યા હતા. પાછી આવીશ. અવામી લીગ વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને મોટા વારંવાર ઉભી થઈ છે. હું હંમેશા પાયે હિંસાના ડરને કારણે, શેખ હસીનાએ ૫ ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ ખબ મહેનત કરી છે. આ એ જ દેશ છોડી દીધો. રાજકીય અસ્થિરતા વચ્ચે છે જેના માટે મારા પિતા અને સેનાએ વચગાળાની સરકાર પરિવારના સભ્યોએ પોતાનો જીવ બનાવવાની જાહેરાત કરી હતી. આપ્યો હતો. વિરોધ કરી રહેલા ત્યારબાદ ગયા સપ્તાહે ગુરુવારે નોબેલ પુરસ્કાર વિજેતા અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારે કાર્યભાર

ઓગસ્ટમાં વરસાદનો એવો રાઉન્ડ આવશે : આગાહીકારોની ભવિષ્યવાણી

# ૧૫ ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

વરસાદની શક્ચતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્ચતા રહેશે. ભારે વરસાદના લીધે પુરની સ્થિતિ સંભવી શકે છે. ૮થી ૧૪ ઓગસ્ટ સુધીમાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્ચતા છે. ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. ટ્લ કીટ, દેશમાં ત્રીજી વખત સત્તાથી આગામી મહિનામાં વરસાદની

**અમદાવાદ,** અંબાલાલ પટેલે કહ્યું આગાહી કરતાં અંબાલાલ પટેલે નથી. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, કે, ૧૫ ઓગસ્ટથી રાજ્યમાં સારા જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર ૯ અથવા તો ૧૦મી તારીખે એક મહિનો ભારેથી અતિભારે રહેશે. વરસાદનો રાઉન્ડ આવશે. બંગાળની ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત દેશભરમાં સારા વરસાદની શક્ચતા પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા છે.

ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે. ૯ કે૧૦મી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ ૧૧ કે ૧૨ તારીખે પૂર્ણ થઇ જશે. આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે. બહું લાંબો રાઉન્ડ નહીં હોય. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ૮ અને ૯ ઓગસ્ટના સરત. નવસારી. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

#### **YASH CHEMEX LIMITED**

411, 4th Floor, Sigma Icon-1, Opp. Medilink Hospital, Satellite, Ahmedabad - 380015, Gujarat, India, Tele: 079-40028639/26730257/26730258, Email: yashchem@hotmail.com, Website: www.yashchemex.com, CIN: L74110GJ2006PLC048385

	STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE 2024.								
								(Rs. in Lakhs,	except EPS)
		Standalo	ne Un-Audit	ted Financial R	esults	Consoli	dated Un-A	udited Financia	l Results
S N	PARTICULARS	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/06/2023	Quarter Ended 31/03/2024	Year Ended 31/03/2024	Quarter Ended 30/06/2024	Quarter Ended 30/06/2023	Quarter Ended 31/03/2024	Year Ended 31/03/2024
1	. Total Income from Operations	793.22	1,250.34	1,962.54	6,214.74	1,369.28	2,554.33	3,257.93	9,652.58
2	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	75.87	(261.22)	37.45	(156.45)	207.99	(417.73)	162.10	(7.08)
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	75.87	(261.22)	37.45	(156.45)	207.99	(417.73)	162.10	(7.08)
4	Net Profit for the period after Tax (after Exceptional and / or Extra-ordinary items)	23.76	(183.32)	34.34	(91.24)	126.02	(306.25)	135.66	32.86
5	Total Comprehensive Income for the period  [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(13.43)	(110.69)	(25.05)	(36.01)	88.83	234.84	76.27	86.87
6	Equity Share Capital of Face Value Rs. 10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34
7	Earnings Per Share(face value of Re.1/-each) (for continuing and discontinued operations)								
Ш	A : Basic	0.23	(1.79)	0.34	(0.89)	0.93	(2.41)	2.51	(0.27)
L	B : Diluted	0.23	(1.79)	0.34	(0.89)	0.93	(2.41)	2.51	(0.27)

The above is an Extract of the detailed format of Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30,2024 filed with the Stock Exchange unde Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30,2024 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the Comapny i.e. www.yashchemex.com.

The above Un-Audited Standalone and Consolidated Financial Results for the Quarter ended June 30 2024 have been reviewed by the Audit Committee & approved by the Roard of Directors of the Company at their respective meetings held on August 13,2024.

By Order of Board of Directors For Yash Chemex Limited SD/-, Pritesh Y. Shah Date: 13.08.2024 Managing Director, DIN: 0023966

### Vasudhagama Enterprises Limited L65910GJ1989PLC012835

Address: G-04, Newyork Corner Building Behind Kiran Motors, G Highway Bodakdev Ahmedabad GJ 380054 Email id: vasudhagamaenterprises@gmail.com, website:www.vasudhagama.com

(	(EXTRACT OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER / YEAR ENDED								
	ON 30TH JUNE, 2024) Amount in Lakhs								
			Stand	alone		С	onsolidate	ed	
Sr. No.	Particulars	Quarter ended 31st March, 2024	Quarter ended 31st March, 2024	ende d 30th June, 2024	Year ended 31st March, 2024	Quarter ended 30th June, 2024	Quarter ended 31st March, 2024	Year ended 31-03-24	
		Un audited	Audited	Un audited	Audited	Un audited	Audited	Audited	
1	Total income from operations	550.79	449.72	150.29	1288.22	1,006.92	828.39	2112.97	
2	Net Profit/Loss for the Period Before tax and								
	exceptional items	57.83	41.34	10.87	124.81	117.89	80.92	216.28	
3	Net Profit/ (Loss) before tax after exceptional items	57.83	41.34	10.87	124.81	117.89	80.92	216.28	
4	Net Profit/ (Loss) after Tax and Exceptional Items	43.38	30.31	7.06	92.80	88.43	59.99	161.40	
5	Total Comprehensive Income	43.38	30.31	7.06	92.80	88.43	59.99	161.40	
6	Paid-up Equity Share Capital	1696.45	1696.45	1696.45	1696.45	1696.45	1696.45	1696.45	
7	Earning Per Share								
	Basic	0.26	0.18	0.19	0.11	0.52	0.35	0.19	

Diluted 0.18 0.11 0.52 0.35 0.26 0.19 Note: The above is an extract of the detailed format of Audited Standalone & Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI( Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full financial results are available on Stock Exchange website (www.bseindia.com) and on the Company 's website www.vasudhagama.com

For Vasudhagama Enterprises Limited

Sejal Sanjiv Shah Place: Ahmedabad Date: 12.08.2024 DIN: 09591841

## **ANJANI SYNTHETICS LIMITED**

CIN:L11711GJ1984PLC007048

Registered Office: 221 (Maliya), New Cloth Market O/s Raipur Gate, Ahmedabad, Gujarat, India, 380002. Website: www.anjanisynthetics.com, E-Mail: accounts@anjanisynthetics.com

EXTRACT OF UN-AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2024

				(Rs. IN LAKH	S Except EPS)
			Quarter Ended		Year Ended
Sr. No.	PARTICULARS	30.06.2024	31.03.2024	30.06.2023	31.03.2024
INO.		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations	4407.45	6536.57	5883.93	25676.94
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	70.87	140.43	96.86	473.77
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	70.87	140.43	96.86	473.77
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	53.03	169.42	71.41	425.68
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	53.03	246.05	71.41	502.31
6.	Equity Share Capital	1475.00	1475.00	1475.00	1475.00
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	6,823.30	6,770.27	6,485.27	6,770.27
8.	Earning per share (of Rs. 10/- each)	(Not Annualised)	(Not Annualised)	(Annualised)	(Annualised)
	Basic :	0.36	1.15	0.48	2.89
Nata	Diluted :	0.36	1.15	0.48	2.89

- Note:-1. The above Results have been reviewed by the audit committee and approved by the Board of Directors at their meetings held
- on 13/08/2024. The statutory auditor of the Company have reviewed the said result. 2. The financial results have been prepared in accordance with the companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) as amended prescribed under section 133 of the companies act, 2013 read with rules thereunder and in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations 2015 and SEBI Circular dated July 5, 2016.
- 3. Operations of the Company falls under single reportable Segment i.e. 'TEXTILE'. 4. The financial results for quarter ended 30th June, 2024 have been subjected to Limited Review by the statutory auditors of the company. The Limited Review Report does not contain any qualifications.
- The figures for corresponding previous periods have been regrouped/rearranged wherever necessary. 6. The Figures for the quarter ended 31st, March 2024, are the balancing figures between audited figures in respect of full

financial year and published unaudited year to date figures upto the third quarter of the financial year ending March 31, 2024. For, Anjani Synthetics Limited, Place: Ahmedabad Vasudev S. Agarwal Date: 13.08.2024 (Managing Director) (DIN - 01491403)

# ક્રિષ્ના કેપિટલ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ

(CIN: L67120GJ1994PLC023803) રજિસ્ટર્ડ ઓફિસઃ 403, મૌર્યંશ એલાન્ઝા, પારેખ હોસ્પિટલ પાછળ,શ્યામલ ક્રોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ - 380015, ફોન: 079-26768572, 26768573,

ઈ-મેઈલ: ksbspl@yahoo.in, વેબસાઈટ: www.kcsl.co.in

૩૦મી વાર્ષિક સાધારણ સભાની નોટીસ, બુક ક્લોઝર, ઈ-વોટીંગ માહીતી

આથી કંપનીના સભ્યોને નોટીસ આપવામાં આવે છે કે, ક્રિષ્ના કેપિટલ એન્ડ સિકયરીટીઝ લિમીટેડ ની ૩૦મી વાર્ષિક સાધારણ સભા શક્રવાર, દમી સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે દ.૦૦ કલાકે વિડિયો કોન્ફરન્સ (વીસી / અન્ય ઓડિયો માધ્યમ (ઓએવીએમ) દ્રારા યોજાશે, જેમાં એજીએમ નોટીસમાં દર્શાવ્યા મુજબના બિઝનેસ હાથ ધરાવશે. ભારત સરકારના કોર્પોરેટ મંત્રાલય દ્રારા તેમના પરીપત્રો તથા સિક્યુરીટીઝ અને એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્રારા તેના પરિપત્રોના ને ધ્યાનમાં રાખતા, વાર્ષિક સાધારણ સભાની નોટીસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૩ - ૨૦૨૪ ઈલેક્ટ્રોકનિક મોડ દ્રારા મોકલી આપવામાં આવ્યા છે, જેમનાં ઈમેલ સરનામા કંપની / ડિપોઝીટરી કે આરટીએ માં નોંધાયેલા છે. સભ્યો નોંધ લેશો કે વાર્ષિક એટલે કે બી.એસ.ઈ. લિમીટેડ : http://kcsl.co.in/Noticeweb.aspx પર પણ ઉપલબ્ધ છે તથા ઈ-વોટીંગ ની સુવિધા પૂરી પાડનાર સંસ્થા સિડીએસએલ ની વેબસાઈટ : www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે તથા ઈ-વોટીંગ ની સવિધા પરી પાડનાર સંસ્થા સિડીએસએલ ની વેબસાઈટ : www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

કંપની ધારા, ૨૦૧૩ ની કલમ ૯૧ હેઠળની જોગવાઈઓ તેમજ તે મુજબ ઘડાયેલા નિયમો અન્વયે આથી આ બાબતે પણ નોટીસ આપવમાં આવે છે કે, કંપનીના સભ્યોનું રજીસ્ટર તથા શેર ટ્રાન્સફર બુકસ શુક્રવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૪ થી શુક્રવાર, ૦૬મી સપ્ટેમ્બર, ૨૦૨૪ (બંને દિવસો સહિત) ૩૦મી વાર્ષિક સાધારણ સભાના હેતુઓ માટે બંધ રહેશે.

કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ ની જોંગવાઈ ને કંપનીઓના વ્યવસ્થાપન અને વહીવટ નિયમો, ૨૦૧૪ ના સુધારેલા નિયમ ૨૦ સાથે વાંચતા અને સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેસસ અને ડિસ્કલોઝર રીકવાયરમેન્ટ), રેગ્યલેશન્સ, ૨૦૧૫ ના નિયમ ૪૪ અન્વયે, વાર્ષિક સાધારણ સભાની નોટીસ માં વર્જાવવામાં આવેલા તમામ ઠરાવો ઉપર સભ્યોને તેમનો મત ઈલેક્ટ્રોનિકલી આપવા માટે ઈ-વોટીંગ ની સુવિધા સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમીટેડ (સીડીએસએલ) મારફતે પુરી પાડવામાં આવેલ છે. મતના અધિકાર સભ્યો પાસે શક્રવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ની

સ્થિતી મુજબ રહેલા શેર્સની સંખ્યાના આધારે પ્રમાણસર ગણાશે, કે જે કટ-ઓફતારીખ છે. રિમોટ ઈ-વોટીંગનો દિવસ, તારીખ અને સમય મંગળવાર, સપ્ટેમ્બર ૦૩, ૨૦૨૪ (સવારે ૯.૦૦ કલાકે) થી શરૂ થશે અને ગુરુવાર, સપ્ટેમ્બર, ૦૫, ૨૦૨૪ (સાંજે ૫.૦૦ કલાકે) થી પુરો થશે. આ સમયગાળા દરમ્યાન, સભ્યો ઈલેક્ટ્રોનિકલી મત આપી શકે, એ પછી રીમોટ ઈ-વોટીંગ મોડયુલ ડીએબલ કરી દેવામાં આવશે. રિમોટ ઈ-વોટીંગનો વિકલ્પ નહી ઉપયોગ કર્યો હોય અને જે સભ્યો વાર્ષિક સાધારમ સભામાં વીસી / (ઓએવીએમ) દ્રારા હાજર રહ્યા હશે તે સભ્યો વાર્ષિક સાધારણ સભામાં ઈલેકટ્રોનિક સિસ્ટમ દ્રારા મત આપી શકશે.

એકવાર કોઈ સભ્યે કોઈ ઠરાવ ઉપર રિમોટ ઈ-વોટીંગ દ્રારા મત આપી દિધો હતો તો તેઓ વીસી (ઓએવીએમ) દ્રારા વાર્ષિક સાધારણ સભામાં ભાગ લઈ શકશે પણ તેમને વાર્ષિક સાધારણ સભામાં ફરીથી મતદાન કરવાની મંજૂરી મળશે નહીં.

જો કોઈ વ્યક્તિ સાધારણ સભાની નોટીસ આપ્યા બાદ અને કટ-ઓફ તારીખ, જેમ કે શુક્રવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૪ ના પહેલાં કંપનીના શેર ખરીધા હોય અને કંપનીના સભ્ય બન્યા હોય તો તો ઓ ઈ-વો ટીંગાની યુઝર આઈડી અનો પાસાવર્ડ મેળવવા માટે helpdesk.evoting@cdslindia.com પર ઈમેલ કરી શકે છે અને વાર્ષિક સામાન્ય સભાની નોટીસમાં આપવામાં આવેલ માર્ગદર્શિકા, યુઝર આઈડી અને પાસવર્ડ સહિત માર્ગદર્શિકા મુજબ વોટ આપી શકે છે, કંપની અને સીડીએસએલ ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જો કે તમે સીડીએસએલ પાસે રીમોટ ઈ-વોટીંગ માટે પહેલાથી રજીસ્ટર હોય તો મતદાન માટે તમે તમારો હાલનો યુઝર આઈડી અને પાસવર્ડ ના ઉપયોગથી પોતાનો મત આપી શકો છે.

ઈ-વોટીંગ અને વીડિયો સંગઠન (વીસી) / અન્ય વિડીયો વિઝયુઅલ મીન્સ (ઓએવીએમ) ની મારફતે વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવાની સંબંધિત કોઈ પ્રશ્ન અથવા સમસ્યાઓ છે, તો તમે વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQS") નો સંદર્ભ લો અને www.evotingindia.com પર આપવામાં આવેલ ઈ-વોટીંગ મેન્યુએલ નો સંદર્ભ લો અથવા helpdesk.evoting@cdslindia.com પર ઈમેલ કરી શકો છો અથવા ૧૮૦૦૨૨૫૫૩૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો અથવા તો શ્રી રાકેશ દલવી, સીડીએસએલ ડીપોઝીટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમીટેડ, ૨૫માં માળે, વિભાગ એ. મેરેથોન ક્યુંચરએક્ષ. મફતલાલ મિલ્સ મેદાન, એન.એમ. માર્ગ, લોએર પરેલ (ઈ), મુંબઈ ૪૦૦૦૧૩, ઈમેલ : helpdesk.evoting@cdslindia.com, ફોન : ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ૫૨, ફોન નં. ૦૨૨-૨૩૦૪૮૫૪૨ / ૪૩, વાર્ષિક સામાન્ય સભાને લગતી માહિતી કંપનીની વે બારાાઈટ: www.kcsl.co.in, સાીડીએ સાએ લનાી વે બારાાઈટ: www.evotingcdslindia.com તથા સ્ટોક એક્સચેન્જ ની વેબસાઈટ : www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

આગારમભ : ભાજ

તારીખ : ૧૩.૦૮.૨૦૨૪

બોર્ડ હારા ઓર્ડર હારા. ક્રિષ્ના કેપીટલ એન્ડ સિકચોટીરીઝ લિમીટેડ માટે,

અશોક્કુમાર અગ્રવાલ મેનેજાંગ ડિરેક્ટર, डीन - ००६४४७३५

# અમરનાથ સિક્યોરીટીઝ લિમીટેડ

CIN: L67120GJ1994PLC023254

રજી. ઓફિસ : ૧/૧૦૪, સાર્થક, સી.ટી. સેન્ટરની સામે, સ્વસ્તિક ક્રોસ રોડની પાછળ, સી.જી. રોડ, અમદાવાદ - ૩૯૦૦૦૯. કોર્પોરેટ ઓફિસ નં. ૫૦૬ અને ૫૦૯, પાંચમો માળ, મીડાસ, સહાર પ્લાઝા, અંધેરી કુરલા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૫૯ તા. ૩૦.૦૬.૨૦૨૪ ના રોજ સમાપ્ત થયેલા ક્વાર્ટર માટે અનઓડીટેડ નાણાંકીય પરીણામોનું નિવેદન

				(55	ક્રમ રૂપિચામાં)
			કવાર્ટર સમાપ્લ	1	પૂર્ણ થચેલ વર્ષ
ક્રમ ક	વિગતો	૩૦.૦૬.૨૦૨૪ (અનઓડીટેડ)	૩૧.૦૩.૨૦૨૪ (ઓડીટેડ)	30.05.૨0૨3 (અનઓડીટેડ)	૩૧.૦૩.૨૦૨૪ (ઓડીટેડ)
1	કામગીરીમાંથી આવક	9.710	9.671	10.188	40.874
	અન્ય આવક	-	0.009	-	0.059
	કુલ આવક	9.710	9.680	10.188	40.933
2	ખર્ચાઓ	0,000	0.700	1.050	2 400
	કર્મચારી લાભ ખર્ચ નાણાંકીય ખર્ચ	0.900 0.500	0.700 0.486	1.050 1.268	3.400 3.046
	આમુલ્યન અને ૠણમુકિત ખર્ચ	0.500	0.400	1.200	3.040
	અન્ય ખર્ચાઓ	1.546	0.798	5.179	8.292
	કુલ ખર્ચાઓ	2.947	1.984	7.497	14.737
3	અસાધારણ વસ્તુઓ પહેલાં નફો / (નુકસાન) અને ટેક્ષ (૧-૨)	6.763	7.696	2.691	26.195
4	અપવાદરુપ વસ્તુઓ	-	-	-	
5	કર પહેલાં નફો / (નુકસાન)	6.763	7.696	2.691	26.195
6	ટેક્ષ ખર્ચ (૧). હાલનો કર (૨). વિલંબીત કર	1.836	2.059	0.717	7.485
7	કર પછીની સામાન્ય પ્રવૃતિઓમાંથી નફો/(નુકશાન)	4.927	5.637	1.974	18.711
8	અન્થ વ્યાપક આવક (OCI) નાણાંકીય અસ્કથામતોના વાજબી મુલ્યાંકન પર માન્યતા પ્રાપ્ત થવા પર નફો અથવા નુકશાન નફો/ (નુકશાન) માટે ફરીથી વર્ગીકૃત કરવામાં આવશે. આ વસ્તુઓને લગતી આવકવેરો		-	-	
	કુલ અન્ય વ્યાપક આવક (OCI)			-	
9	સમયગાળા માટે નફો (નુકશાન)	4.927	5.637	1.974	18.711
	પેઈંડ અપ ઈક્વિટી શેર મૂંડીના સમયગાળા માટે નફો (નુક્શાન) (શેર દીઠ રૂા. ૧૦ ફેસ વેલ્યુ)	300.020	300.020	300.020	300.020
10	શેર દીઠ કમાણી (EPS) (વાર્ષિક નથી) (૧). પાચાની (૨). પાતળું	0.16 0.16	0.19 0.19	0.07 0.07	0.62 0.62

વ. ઉપરોક્ત નાણાંકીય પરિણામો જે સિકયોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન એન્ડ ડિસ્કલોઝર રિકવાયરમેન્ટ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના નિયમન ૩૩ અનુસાર પ્રકાશિત કરવામાં આવ્યાં છે તેની સમીક્ષા કરવામાં આવી છે અને ઓડિટ સમિતિ દ્રારા ભલામણ કરવામાં આવી છે. તા. ૧૩.૦૮.૨૦૨૪ ના રોજ યોજાયેલી મીટીંગ કરી હતી.

તા. ૩૧.૦૩.૨૦૨૪ ના રોજ પૂરા થયેલા ત્રિમાસીક ગાળાના આંકડા એ તા. ૩૧.૦૩.૨૦૨૪ ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીના સંપૂર્ણ નાણાંકીય વર્ષના ઓડીટ કરાયેલા આંકડા અને અનઓડીટેડ વર્ષ સુધીના આંકડા

વૈધાનિક ઓડીટર્સ ૩૦મી, જુન ૨૦૨૪ ના રોજ પૂરા થયેલા કવાર્ટર સમાપ્ત માટે સ્ટેનડઅલોન અનઓડિટેડ નાણાંકીય પરિણામોની મર્યાદીત સમીક્ષા હાથ ધરી છે.

અમરનાથ સિક્ચોરીટીઝ લિમીટેડ, કંપની પાસે માત્ર એક જ બિઝનેશ સેગમેન્ટ છે.

નરેશ પધીર. વોલ ટાઈમ ડાયરેક્ટર,

સ્થળ : અમદાવાદ તારીખ : ૧૩.૦૮.૨૦૨૪ DIN: 08379067